



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૩/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૯૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૪ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૩૮ લીટર દેશી દારૂ અને ૩૭ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી ૧૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૨,૩૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૯૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૩૯૮/૧૯

કાગડાપીઠ: પ્રદિપ અમીરચંદ અગ્રવાલ (રહે. પંચતિર્થ સોસાયટી સ્ટાર બજાર સામે સેટેલાઇટ) એ તા.૦૧/૦૩/૧૯ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૪/૧૭ થી તા.૦૯/૦૭/૧૮ સુધીના સમયગાળા દરમિયાન રાયપુર દરવાજા બહાર ન્યુ ક્લોથ માર્કેટમા દુકાન નં- ૭/૧ મા શ્રી સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ નામની દુકાન ખાતેથી આરોપી વિકાસ બિજકિશોર અગ્રવાલ (રહે. ગુલાબ પાર્ક સોસાયટી સેટેલાઇટ) એ પ્રદિપ અગ્રવાલને વિશ્વાસમાં લઈ ૩૯,૯૧,૨૫૪/- રૂપિયાનો કાપડનો માલ લઈ જઈ નાણા નહી ચુકવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એ જાડેજા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૩૯૯/૧૯

ખોખરા: કિશનલાલ મુક્તિરામ પ્રજાપતિ (રહે. ગણેશચોક વિનોબાભાવેનગર જી.આઇ.ડી.સી.વટવા) એ ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૨/૧૯ રાતના ૯/૦૦ થી તા.૦૧/૦૩/૧૯ કલાક ૯/૦૦ વાગ્યા દરમિયાન શ્રુતી કોમ્પ્લેક્ષમાં દુકાન નં બી/૧/૬ પ્રજાપતી ઓટો સેન્ટર નામની તથા વિશ્વાસપાર્ક શોપીંગ સેન્ટર દુકાન નં ૮,૯ કૃષ્ણા ઓટો પાર્ટસ નામની દુકાનોના તાળા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાંથી જરૂરી દસ્તાવેજ અને રોકડ રોપિયા મળી કુલ રૂપિયા ૧,૧૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.બી.પરમાર ચલાવે છે.

સ્લેબ તુટી પડતા મૃત્યુ :

સમાચાર યાદી નં.૪૦૦/૧૯

જીઆઈડીસી વટવા: ગોવિંદભાઈ નાથુભાઈ મેણા (ઉ.વ.૨૭) (રહે. ખોળીવારનગર ચંદ્રભગા સોસાયટી સામે ઓઢવ) તા.૦૧/૦૩/૧૯ બપોરના ૪/૪૫ વાગ્યાના સુમારે વટવા જીઆઈડીસી ફેઝ-૩ પ્લોટ નં-૨૧૦૪ માં આવેલ નીશા એન્ટરપ્રાઇઝ ફેક્ટરીમાં કડીયા કામ કરતા હતા ત્યારે ત્યારે જુનો સ્લેબ પડતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ડાહ્યાભાઈ પન્નાભાઈ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૪૦૧/૧૯

ઘાટલોડીયા: પ્રતાપસિંહ નવલસીંહ રાજપુત (ઉ.વ.૩૨) (રહે. સાંકેત રો-હાઉસ સોસાયટી મેમનગર) એ અગમ્ય કારણસર તા.૦૧/૦૩/૧૯ કલાક ૧૦/૫૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.ઇ.શ્રી પી.એમ.ગામીત ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.